

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**Diploma Engineering - SEMESTER-V • EXAMINATION – SUMMER 2013****Subject Code: 355401****Date: 10-05-2013****Subject Name: Tax Laws and Practice-I****Time: 10:30 am - 01:00 pm****Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. English version is considered to be Authentic.

- Q.1** (a) Write notes on the following. **07**
 1. Levy of Tax
 2. Step & Slab system of assessing tax
- (b) Classify the following under the definition of 'Person' **07**
 1. M/s. Sunil Shah & Sons
 2. Mohanlal Shah
 3. Vikas Bank Ltd.
 4. Bharuch Consumers' Co.op Society
 5. Gujarat University
 6. Gopal & his joint family
 7. Baroda Sports Club
- Q.2** (a) Write notes on the following (Any Two) **07**
 1. Previous year
 2. Assessee
 3. Residential status of an Individual assessee
- (b) State the heads under which following incomes are included **07**
 1. Dividend received on the shares of Ltd. Co.
 2. Arrears of pay received by a professor.
 3. Rent received by the tenant on sub-let of house.
 4. Interest received on I.D.B.I. Bonds.
 5. Income from winning horse-race.
 6. Income from agriculture land situated in Tamilnadu.
 7. Fees received by a singer.
- OR**
- (b) Attempt any Two: **07**
 (1) Income Tax Officer.
 (2) Permanent Account Number (PAN).
 (3) Bond Washing Transaction.
- Q.3** (a) Write notes on the following. **07**
 1. Perquisites totally tax free for all class of employees.
 2. Motor car facility.
- (b) Explain on fully exempted income - Any Seven. **07**
- OR**
- Q.3** (a) Discuss on: **07**
 (1) Person.
 (2) Assessee.
- (b) Explain on Agricultural Income. **07**

Q.4

- (a) Write note on – Return of Income 07
(b) Write note on – Fully exempted Incomes 07

OR

Q. 4

- (a) Write note on – Income Tax Officers 07
(b) Describe – Kinds of Provident Funds 07

Q.5

- (a) Mr. Ronak Patel is marketing manager of a company in Vapi. Details of his income for the year 2009-10 are as under: 07
(1) Basic Pay Monthly Rs. 15,000
(2) D. A. at 40% of basic pay.
(3) H. R. A. at 25% of basic pay (Actual house rent paid monthly Rs. 3,000)
(4) Bonus Rs. 15,000
(5) Professional tax paid Rs. 2,000
(6) Medi-Claim premium paid Ra. 1,200
During the year he has paid Life Insurance Premium Rs. 7,000 on his Life Policy and deposited Rs. 20,000 in public provident fund account.
Compute his taxable salary income and Total Taxable income for the Assessment year 2010-2011
(b) (1) Explain on TDS 07
(2) Explain on PAN

OR

Q.5

- (a) Explain in Detail: 07
(1) Dividend.
(2) Total Income
(b) Explain on Advance Payment of Tax. 07

પ્રશ્ન-૧

- અ નીચેના પર નોંધ લખો. 09
1. કરનું ભારણ
2. કરની આકારણીની સ્ટેપ અને સ્લેબ પદ્ધતિ
બ 'શપ્સ' ની વ્યાખ્યા સંદર્ભે નીચેનાનું વર્ગીકરણ કરો. 09
1. મેસર્સ સુનીલશાહ એન્ડ સન્સ
2. મોહનલાલ શાહ
3. વિકાસ બેંક લીમીટેડ
4. ભરૂચ ગ્રાહક સહકારી મંડળી
5. ગુજરાત યુનિવર્સિટી
6. ગોપાલ અને તેનું સંયુક્ત કુટુંબ
7. બરોડા સ્પોર્ટ્સ ક્લબ

પ્રશ્ન-૨

- અ નીચેના પર નોંધ લખો. (ગમે તે બે) 09
1. પાછલું વર્ષ
2. કરદાતા
3. કરભરનાર વ્યક્તિનો રહેમણનો દરજ્જો
બ નીચેની આવકો કયા મથાળા હેઠળ સમાવાશે તે દર્શાવો. 09
1. લીમીટેડ કંપનીના શેર પર મળેલ ડીવીડન્ડ
2. પ્રોફેસરને મળેલ બાકી લેણો પગાર
3. મકાન પેટે ભાડે આપતાં ભાડુઆતને મળેલ ભાડાની આવક
4. આઈ.ડી.બી.આઈ. ના બેન્કના વ્યાજની આવક
5. ઘોડા-દોડની જીતમાંથી મળેલ આવક
6. તામીલનાડુ સ્થિત ખેતીની જમીનની આવક

7. ગાયકને મળેલ ફી

અથવા

બ	ગમે તે બે લખો: (1) આવકવેરા અધિકારી (2) કાયમી ખાતા નંબર (3) બોન્ડ વોશિંગ વ્યવહાર	૦૭
પ્રશ્ન-૩		
અ	નીચેના પર નોંધ લખો. 1. બધાજ પ્રકારના કર્મચારીઓ માટે સંપૂર્ણ પણે કરમુક્ત ગણાતી સવલતો. 2. મોટરકારની સવલત	૦૭
બ	સંપૂર્ણ કરમુક્ત સાત આવકો જણાવો.	૦૭
	અથવા	
પ્રશ્ન-૩		
અ	નીચેના વિષે જણાવો: (1) આકસ્મિક આવક (2) આકારણીના પ્રકારો	૦૭
બ	સંપૂર્ણ કરમુક્ત સાત આવકો જણાવો.	૦૭
પ્રશ્ન-૪		
અ	આવકનું પત્રક - પર નોંધ લખો.	૦૭
બ	સંપૂર્ણ કરમુક્ત આવકો - પર નોંધ લખો.	૦૭
	અથવા	
પ્રશ્ન-૪		
અ	આવકવેરા અધિકારીઓ - પર નોંધ લખો.	૦૭
બ	પ્રો. ફંડના પ્રકારો વર્ણવો.	૦૭
પ્રશ્ન-૫		
અ	શ્રી રોનક પટેલ વાપી સ્થિત એક કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે. પાછલું વર્ષ ૨૦૦૮-૧૦ની તેમની આવકની વિગતો નીચે મુજબ છે: (1) મૂળ પગાર રૂા. ૧૫,૦૦૦ (2) મોંઘવારી ભથ્થું મૂળ પગારના ૪૦% (3) ઘરભાડા ભથ્થું મૂળ પગારના ૨૫% લેખે(ખરેખર ચૂકવેલ ઘરભાડું માસિક રૂા. ૩૦૦૦) (4) બોનસ રૂા. ૧૫,૦૦૦ (5) વ્યવસાયવેરો ચૂકવ્યો વાર્ષિક રૂા. ૨,૦૦૦ (6) મેડી-ક્લેઈમ પ્રિમીયમ રૂા. ૧,૨૦૦ વર્ષ દરમિયાન તેમણે તેમની જીંદગી વીમા પોલિસીનું પ્રિમીયમ રૂા. ૭,૦૦૦ ચૂકવ્યું હતું અને જાહેર ભવિષ્યનિધી ખાતામાં રૂા. ૧૦,૦૦૦ જમા કરાવ્યા હતા. આારણી વર્ષ ૨૦૧૦-૧૧ માટે તેમની પગારની કરપાત્ર આવક અને કુલ કરપાત્ર આવકની ગણતરી કરો.	૦૭
બ	(1) ટીડીએસ (TDS) અંગે વર્ણન કરો. (2) પીએએન (PAN) અંગે વર્ણન કરો.	૦૭
	અથવા	
પ્રશ્ન-૫		
અ	વિગતવાર વર્ણન કરો: (1) ડિવીડન્ડ. (2) સંપૂર્ણ આવકો.	૦૭
બ	આગોતરા કર ચૂકવવા વિષે સમજાવો.	૦૭
